

શરતો :

૧. ટેન્ડર સાથે ઇ.એમ.ડી.ની રકમ રૂ.૨૫,૦૦૦.૦૦ (અંકે રૂપિયા પચ્ચીસ હજાર પુરા) ની એફ.ડી.આર. મુખ્ય અધિકારી, ખેરાલુ નગરપાલિકા, ખેરાલુના નામની રજૂ કરવાનો રહેશે.
૨. કોન્ટ્રાક્ટર તરફથી ટેન્ડર ફોર્મ મેળવવા ભરેલ ટેન્ડર ફી ની રકમ પરત આપવામાં આવશે નહિ.
૩. ટેન્ડર મંજૂર થયેથી જરૂરી એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટરે પોતાના સ્વખર્ચે જરૂરી એવા સ્ટેમ્પ પેપર ઉપર નગરપાલિકા નક્કી કરે તેવી શરતો કબુલ/માન્ય રાખતું કરીને નગરપાલિકામાં રજૂ કરવાનું રહેશે.
૪. કોન્ટ્રાક્ટર ધ્વારા ટેન્ડરની માંગણી વખતે કોન્ટ્રાક્ટરનું રજીસ્ટ્રેશન, ઇન્કમેટેક્સ ક્લીયરન્સ સર્ટી, સોલવન્સી સર્ટી, જી.એસ.ટી. રજીસ્ટ્રેશન નંબર, ઇ.પી.એફ. રજીસ્ટ્રેશન વિગેરેના મૂળ પ્રમાણપત્રો નગરપાલિકામાં રજૂ કરવાના રહેશે. તમામ દસ્તાવેજ રજૂ કર્યેથી ટેન્ડર ઇસ્યુ કરવામાં આવશે.
૫. ટેન્ડર મંજૂર થયા બાદ કામ શરૂ કરવા માટે સિક્યોરીટી ડીપોઝિટ નગરપાલિકામાં રજૂ કર્યેથી અને ત્યાર બાદ જરૂરી કોન્ટ્રાક્ટ/એગ્રીમેન્ટ થયા બાદ વર્ક ઓર્ડર આપવામાં આવશે અને કોન્ટ્રાક્ટરે વર્ક ઓર્ડર મુજબ તુર્ત જ કામ શરૂ કરવાનું રહેશે.
૬. ટેન્ડર નોટીસના કામ માટે વાપરવાના ઉપયોગમાં લેવાનો જરૂરી માલસામાન, મટીરીયલ્સ, મજૂરી કામ, વાલનટેક્સ, એક્સાઈઝ ડ્યુટી, સેલટેક્સ વિગેરેમાં ભાવ વધારો અગર વેરો વધારો ભવિષ્યમાં થાય તો મંજૂર થયેલ ટેન્ડરના ભાવ કરતા વધુ ભાવની રકમો માગવા કોન્ટ્રાક્ટર હકકદાર રહેશે નહિ.
૭. મંજૂર થયેલ ટેન્ડર મુજબ કરવાના થતા કામ માટે જરૂરી માલસામાન જેવા કે સિમેન્ટ, રેતી, કપચી, મેટલ, સ્ટીલ, ડામર રોડ ને લગતા મટીરીયલ્સ વિગેરે કોઈ પણ મટીરીયલ્સ ઉપર નગરપાલિકા તરફથી કોઈ રકમ એડવાન્સ તરીકે આપવામાં આવશે નહિ.
૮. ભાવ ભરનાર કોઈ પણ કોન્ટ્રાક્ટર કામ કરવાનો ઇન્કાર કરશે તો તેની બાનાની રકમ નગરપાલિકા ધ્વારા જપ્ત કરવામાં આવશે.
૯. મંજૂર કરેલ ટેન્ડર મુજબ નગરપાલિકાના મુખ્ય અધિકારી અને એન્જનીયર સૂચના તેમજ ટેન્ડર સ્પેસિફિકેશન મુજબ કરવાની રહેશે.
૧૦. નગરપાલિકા ધ્વારા આ કામ કરાવવા વર્ક ઓર્ડર આપવામાં આવેલ હોય અને કોન્ટ્રાક્ટર/ઈજારદાર દર્શાવેલ સમય મર્યાદામાં કામગીરી ન કરે તો સેકન્ડ લોએસ્ટ ભાવવાળાને કામગીરી સુપ્રત કરવામાં આવશે. સેકન્ડ લોએસ્ટના ભાવથી કામગીરી કરાવી પ્રથમ અને બીજા કોન્ટ્રાક્ટર વચ્ચેના ભાવ ફેરની રકમ ઉપરાંત સેકન્ડ લોએસ્ટને બજાર ભાવ ઉંચા હોઈ થનાર નુકશાનની રકમ પણ પ્રથમ લોએસ્ટ કોન્ટ્રાક્ટર પાસેથી ભરવામાં આવેલ ટેન્ડરની સીક્યોરીટી ડીપોઝિટની રકમ અથવા નગરપાલિકામાંથી બાકી લેણાંના બિલની રકમ નગરપાલિકા ધ્વારા જપ્ત કરવામાં આવશે.
૧૧. કરેલ કામગીરીના ટેસ્ટીંગ રીપોર્ટ સમયાંતરે આપવાના રહેશે.
૧૨. રીપેરીંગ કામો દરમ્યાન નિકળેલ માટી-બાંધકામ ડેમેજ વિગેરે સમય મર્યાદામાં કામના સ્થળેથી ઉપાડી લેવાનો રહેશે. તેમજ સી.સી. કામ કરેલ હોય ત્યાં પાણી છાંટવાનું કામ સમય મર્યાદા સુધી ચાલુ રાખવાનું રહેશે. ઉપર બંને કરવાની થતી કામગીરી સમય મર્યાદામાં ન થાય તો તેવા સંજોગોમાં નગરપાલિકા અન્ય એજન્સી પાસેથી તેના મંજૂર થયેલ ભાવથી આ કામગીરી કરાવશે. તે માટેનું વહીવટી તથા સાધનિક તમામ ખર્ચ દંડ સહિત ચુકવવાના થતા બિલમાંથી કપાત કરવામાં આવશે.

૧૩. ટેન્ડર મંજૂર થતા ૨.૫% સી.ડીપોજીટ તરીકે મુખ્ય અધિકારી, ખેરાલુ નગરપાલિકાના નામે જમા કરાવવાની રહેશે. તેમજ ચૂકવણાના બિલમાંથી ૨.૫% સીક્યોરીટી ડીપોજીટ તરીકે કપાત કરવામાં આવશે.
૧૪. સિમેન્ટ ફક્ત મેજર પ્લાન્ટનો વાપરવાનો રહેશે. આ સિવાયનો સિમેન્ટ માન્ય ગણવામાં આવશે નહિ.
૧૫. બિલનું ચૂકવણું સ્વભડોળની જોગવાઈ મુજબ કરવામાં આવશે. ચૂકવણાના વિલંબ થવા અંગે કોઈ જ પ્રકારનું વળતર મળવાપાત્ર રહેશે નહિ. જેમાં એજન્સી કોઈ પણ પ્રકારનો હક્ક દાવો કરી શકાશે નહિ.
૧૬. બિલના ચૂકવણામાંથી નિયત અનુસાર અમલમાં હોય તે નિયમો મુજબ ઈન્કમ ટેક્સ/વેલ્ફેર સેસ ટેક્સ કપાત કરી ચૂકવણું કરવામાં આવશે.
૧૭. ટેન્ડર સાથે મંગાવવામાં આવેલ તમામ આનુષંગિક દસ્તાવેજો રજૂ કરવામાં ન આવે કે અધુરી માહિતી વાળા ટેન્ડરો ખોલવામાં આવશે નહિ.
૧૮. ટેન્ડરની વેલીડિટી પ્રાઈસ બિડ ખોલ્યા તારીખથી ૧૨૦ દિવસ ગણાશે.
૧૯. મુદત બહાર, અધુરી વિગતે કે શરતી ટેન્ડર વિચારણામાં લેવામાં આવશે નહિ અને રદ બાતલ થવાને પાત્ર રહેશે.
૨૦. શીડ્યુલ-બી માં દર્શાવેલ ટેન્ડર દર માટે ૧૮% જી.એસ.ટી. (G.S.T.) નગરપાલિકા ધ્વારા અલગથી ચૂકવવામાં આવશે.
૨૧. સરકારના પ્રવર્તમાન જોગવાઈ મુજબ એસ.જી.એસ.ટી. ૧% અને સી.જી.એસ.ટી. ૧% નગરપાલિકા ધ્વારા બિલમાંથી જી.એસ.ટી. ટી.ડી.એસ. તરીકે કપાત કરવામાં આવશે.
૨૨. મંજૂર થયેલ ભાવો તા.૩૧/૦૩/૨૦૨૭ સુધી અથવા વાર્ષિક ભાવની અન્ય એજન્સી નક્કી ન થાય ત્યાં સુધી મંજૂર થયેલ ભાવોથી કામગીરી કરવાની રહેશે.
૨૩. નગરપાલિકા સૂચવે તે કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરી આપવાની રહેશે.
૨૪. ભાવો અંગે આખરી સત્તા નગરપાલિકા, ખેરાલુને અબાધિત રહેશે.
૨૫. ભાવો મંજૂર થયા પહેલા/બાદ મતભેદ વિવાદ ઉપસ્થિત થાય તેવા સંજોગોમાં મુખ્ય અધિકારી, ખેરાલુ નગરપાલિકાનો નિર્ણય આખરી ગણાશે. જે સંબંધિતોને બંધનકર્તા રહેશે.
૨૬. **Asphalt Rate Variation – Star Rate** ડામર ના બજાર દરોમાં સમયાંતરે તથા ફેરફારોને ધ્યાનમાં રાખીને, કરાર દરમ્યાન દરમાં નોંધપત્ર વધારો અથવા ઘટાડો થાય તો સંબંધિત આઈટમો માટે સ્ટાર રેટ લાગુ કરવામાં આવશે. આવા કેસમાં દર વિગતવાર રેટ એનાલિસિસ તથા તે સમયના પ્રચલિત બજાર દરના આધારે નક્કી કરવામાં આવશે. દર નક્કી કરતાં પહેલા સત્તાધિકૃત અધિકારીની મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. મંજૂર થયેલ દર મુજબ માપપુસ્તકના આધારે જ ચૂકવણી કરવામાં આવશે.

ઈજરદારશ્રી નામ અને સહી

રબર સ્ટેમ્પ સાથે